

ચોકબજારની મોબાઇલ શોપમાંથી મોબાઇલોની ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાંચ.

આજરોજ મે.નાયબ પોલીસ કમિશ્નર સાહેબશ્રી ક્રાઇમ તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી ક્રાઇમ સાહેબનાઓની સુચના તથા પો.ઇન્સ.શ્રી એ.એમ.કેપ્ટન નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી કે.કે.ગોહિલ તથા પોલીસ માણસો સાથે શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ. દિનેશભાઈ મગનભાઈ તથા અ.હે.કો.વિજયભાઈ નટવરભાઈનાઓને મળેલ બાતમીના આધારે અમરોલી માનસરોવર ત્રણ રસ્તા પાસેથી આરોપી નામે (૧) પપ્પુ રામદુલારે મુખદેવ રાજભર ઉ.વ.૨૨ રહે.એચ-૧,બીલ્ડીંગ નં.૩૯ રૂમ નં.૧૦ કોસાડ આવાસ અમરોલી સુરત મુળ ગામ- કથરીયા નરહી, થાના લક્ષ્મણપુર, જી-બલીહા યુ.પી.તથા(૨) સંજય પ્રભુદાસ તિકદમ મલા (સહાની) ઉ.વ.૧૯ રહે.એચ-૧, બીલ્ડીંગ નં.૮૯-બી, રૂમ નં.૨૨, કોસાડ આવાસ અમરોલી, સુરત મુળ ગામ- પીડઉત, થાના-ગોસી જી.મઉ.(યુ.પી) (૩) શીવરાજસીંહ ચાવઠ્ઠસીંહ સોલંકી ઉ.વ.૩૮ રહે.૧૦૮, ત્રિલોક સોસાયટી અખંડ આનંદ કોલેજની સામે વેડરોડ સુરત મુળ ગામ ઢીલોડીયા, પોસ્ટ ઉમરવાસ થાના-ચારબજાર, જી-રાજસમદ રાજસ્થાન

ઉપરોક્ત આરોપીઓ પાસેથી મળેલ થેલામાં તથા પ્લાસ્ટીકની ગુણમાંથી અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૧૦૧, જેની કુલ કિંમત રૂ.૧૦,૯૪,૯૨૮/- મળી આવેલ છે. મજકુર આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઇલ ફોન બાબતે ઘનીષ્ઠ પુછપરછ કરતા વેડોરોડ કેશવપાર્ક સોસાયટીની સામે પંડોળ શોપીંગ સેન્ટર દુકાન નં.૪૧ નર્મદા માર્કેટીંગ મોબાઇલની દુકાન બાકોરૂ પાડી દુકાનમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે. તે આધારે ચોકબજાર પો.સ્ટે. I ગુ.ર.નં.૪૯/૨૦૧૭ ઇ.પી.કો.કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ ઘરફોડ ચોરીનો ગુન્હાનો ભેદ ઉકેલાયેલ છે.

ઉપરોક્ત આરોપીઓ પૈકી પપ્પુ રામદુલારે મુખદેવ રાજભર ગુનો કરવાની ટેવવાળો રીઢો ગુનેગાર છે. અને તે અગાઉ નીચે મુજબના ગુનાઓમાં પણ પકડાયેલ છે. અને તડીપાર પણ કરવામાં આવેલ છે.

(૧) અમરોલી પો.સ્ટે. I ૫૪/૨૦૧૧ IPC ૪૫૭, ૩૮૦ મુજબ (૨) ચોકબજાર પો.સ્ટે. I ૧૫૦/૨૦૧૨ IPC ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબ (૩) ચોકબજાર પો.સ્ટે. I ૧૫૧/૨૦૧૨ IPC ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબ (૪) ચોકબજાર પો.સ્ટે. I ૧૫૨/૨૦૧૨ IPC ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબ (૫) ચોકબજાર પો.સ્ટે. I ૧૫૩/૨૦૧૨ IPC ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબ (૬) પાંડેસરા પો.સ્ટે. I ૧૫૩/૨૦૧૩ IPC ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ